

જેંદ્ર કારીક્રમનું નું તું તું જીવન જીવન કરીનું કરીનું
નનું, લીનું નારી અનુભૂતિનું નારી નું નું જીવનીકરણનું
વ્રયું વાયિ?

પैગંબર મૂસા એક યોદ્ધ થે ઔર દાऊદ ભી એક યોદ્ધ થે। મૂસા ઔર મુહમ્મદ ને, ઉન દોનોં પર અલ્લાહ કી શાંતિ હો, રાજનીતિક ઔર સાંસારિક મામલોં કી બાગડોર સંભાલી ઔર દોનોં ને બુતપરસ્ત સમુદાય સે હિજરત કી। મૂસા -અલૈહિસ્સલામ- અપને સમુદાય કે સાથ મિસ્ત્ર સે નિકલ ગાય ઔર મુહમ્મદ - સલ્લાહુ અલૈહિ વ સલ્લમ- ને યસરિબ (મદીના) કી ઓર પ્રવાસ કિયા। ઇસસે પહેલે ભી આપકે અનુયાયિયોં ને હબ્શા કી ઓર હિજરત કી થી। એસા ઉન દેશોં કે રાજનીતિક ઔર સૈન્ય પ્રભાવ સે બચને કે લિએ કિયા ગયા થા, જહાં સે વે અપને ધર્મ કે સાથ નિકલ ગાય થે। ઇસમેં ઔર મસીહ - અલૈહિસ્સલામ- કે આદ્ધાન કે બીચ કા અંતર યથ થા કિ મસીહ -અલૈહિસ્સલામ- કા આદ્ધાન ગૈર- બુતપરસ્ત લોગોં કે લિએ થા। અર્થાત् યથૂદિયોં કે લિએ। જબકિ મૂસા એવં મુહમ્મદ જિસ માહૌલ (મિસ્ત્ર તથા અરબ) મેં કામ કર રહે થે, વહ બુતપરસ્તોં કા થા। ઇન દોનોં જગહોં કી પરિસ્થિતિયાં કહીં જ્યાદા મુશ્કિલ થીં। મૂસા એવં મુહમ્મદ -ઉન દોનોં પર અલ્લાહ કી શાંતિ હો- કે આદ્ધાન સે જિસ બદલાવ કી આશા કી જાતી થી, વહ એક આમૂલચૂલ ઔર વ્યાપક પરિવર્તન થા। બુતપરસ્તી સે એકેશ્વરવાદ કી ઓર એક વિશાળ પરિવર્તન।

રસૂલ સલ્લાહુ અલૈહિ વ સલ્લમ કે સમય હોને વાલે યુદ્ધોં મેં મરને વાલોં કી સંખ્યા હજાર સે અધિક નહીં થી। વહ ભી અપને આપકી રક્ષા કરતે હુએ, આકામકતા કી પ્રતિક્રિયા મેં યા ધર્મ કી રક્ષા મેં યથ જાને ગઈ। જબકિ દૂસરે ધર્મો મેં ધર્મ કે નામ પર છેડી ગઈ જંગોં મેં મરને વાલોં કી સંખ્યા કો દેખતે હૈનું, તો વહ લાખોં તક પહુંચતી હૈ।

ઇસી પ્રકાર મકાર વિજય કે દિન મુહમ્મદ -સલ્લાહુ અલૈહિ વ સલ્લમ- કી દયા સ્પષ્ટ રૂપ સે સામને આઈ, જબ આપને કહા : આજ રહમ કરને કા દિના હૈ। આપને કુરૈશ કી વ્યાપક માફી કા એલાન કિયા, જિસ કુરૈશ ને મુસલમાનોં કો કષ્ટ પહુંચાને મેં કોઈ કમી નહીં કી થી। ઇસ બુરાઈ કા બદલા ભલાઈ એવં બુરે વ્યવહાર કા પ્રતિફલ અચ્છા વ્યવહાર સે દિયા।

"ભલાઈ ઔર બુરાઈ બરાબર નહીં હો સકતે। આપ બુરાઈ કો એસે તરીકે સે દૂર કરે જો સર્વોત્તમ હો। તો સહસા વહ વ્યક્તિ જિસકે ઔર આપકે બીચ બૈર હૈ, એસા હો જાએગા માનો વહ હાર્દિક મિત્ર હૈ।" [157]
[સૂરા ફુસ્સિલત : 34]

ધર્મપરાયણ લોગોં કે કુછ ગુણ હૈનું। અલ્લાહ તઆલા ને કહા હૈ :

"(ધર્મપરાયણ લોગ વે હૈનું) જો ક્રોધ કો દબા લેતે હૈનું, લોગોં કો ક્ષમા કર દેતે હૈનું ઔર અલ્લાહ ભલાઈ કરને વાલોં કો પસંદ કરતા હૈ।" [158] [સૂરા આલ-એ-ઇમરાન : 134]

ଉଦ୍‌ଦେଶ୍ୟ ପିଲାର୍ଡ ହରଙ୍ଗନ ଓ ପିଲାନ୍ତର

ପାଇସନ୍ସ୍: <http://e-najat.org.kw/00/00/00/60/>

ପାଇସନ୍ସ୍ ପାଇସନ୍ସ୍: <http://e-najat.org.kw/00/00/00/60/>

ପାଇସନ୍ସ୍କରଣ ତାରିଖ 4 ମସି ମସି 2026 03:25:10 ବେଳେ